



માતાનું દૂધ: કુદરતની અણામોલ ભેટ



કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટી,
અઠવાફાર્મ, સુરત - ૩૮૪૦૦૬
ફોન : ૦૨૬૧ ૨૬૫૫૫૬૫

Email: kvksurat@nau.in
Publication No.: NAU/04/05/053/2022

માતાનું દૂધઃ કુદરતની અષ્ટમોલ ભેટ

પ્રો. ગીતા જે. બીજાણી, વૈજ્ઞાનિક (જુહ વિશ્વાન)

ડૉ. એચ. સી. પરમાર, મદદનીય પ્રાધ્યાપક, ડૉ. જે. એચ. રાઠોડ, વર્ષિષ વૈજ્ઞાનિક અને વડા

કૃતિ વિશ્વાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, સુરત

માતાનું દૂધ બાળકને પોપસ આપવા માટેનો કુદરતનો આદર્શ ઉપાય છે. માતાનું દૂધ શીશુને લગભગ બધાંજ પોપકંતંયો પૂરા પાડે છે જે શીશુના ઘૂંઘ્યા અને વિકાસ માટે જરૂરી હોય છે, પરંતુ આ માત્ર મયારીટી સમય પૂરતા જ હોય છે. એ મહિના સુધી માતાના દુધમાંથી શિશુને બધાંજ પોપકંતંયો મળી રહે છે. પરંતુ એ મહિના બાદ શિશુને ઉપરનો જોરાક મેટલે કે પુરુક આહાર આપવો જરૂરી છે. બાળકનો જન્મ થયા બાદ તેને પેટેલા પ્રાણીય ચાર દિવસોમાં આપવું માતાનું દૂધ “કોલરટ્રમ” - ઘાટું પીણાશ પડતું ઘાવાન આપવું જોઈએ. આ દૂધ સમૃદ્ધ પોપક તલ્પોવાનું હોય છે. ઉપરાંત બાળકનું સેગેની સામે રક્ષણ કરે છે. માતાનું દૂધ નાના બાળકો માટે આહારની ઉત્તમ પસંદગી છે. વળી, તેના ફાયદા નીચે પ્રમાણે છે.

- (૧) બાળકની પોપસ રિપયક જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું છે.
- (૨) જલદીથી પરી જાય છે અને તેમાં રહેલાં પોપકંતંયું સહેલાઈથી શોખસ થાય છે.
- (૩) ઘાયા એપી સેગો સામે રક્ષણ કરે છે.
- (૪) બાળકની જરૂરિયાત પ્રમાણે જોઈતા પ્રમાણમાં મળી રહે છે.
- (૫) સરસાંધાં સરસું, સગાડભર્યું અને બાહારના દૂધની સરણામણીમાં ઘણું સ્વરં હોય છે.

માતાનું દૂધ : કુદરતની આણમોલ ભેટ

માતાનું દૂધ બાળક માટે જોરાક કારણ કે તે ખાસ બાળક માટે જ કુદરતે આપેલ આણમોલ ભેટ છે. વળી, માતાનું ઘાવસ આપવું ક્રમાંગ અને સરળ છે. તેનાથી માતાને શારીરિક અને માનસિક લાભ પણ થાય છે. માતાના દૂધના ફાયદા પણ અનેક છે. જેમાંના મુખ્ય નીચે પ્રમાણે ગણાયી રહ્યાં હોય.

- (૧) કુદરતી : માતાનું ઘાવસ કુદરતી છે. તેથી તે હંમેશાં ગોગ્ય ઉષ્ણતામાને અને સહેલાઈથી ઉપલબ્ધ છે. જેના માટે કોઈ તેચારી કરવી પડતી નથી. તેથી માતાને બાળ સંસાર માટે ઘણારે સમય પણ મળે છે.
- (૨) સેગ પ્રતિકારક શક્તિ : માતાનું ઘાવસ તાજુ હોય છે અને તેમાં સેગ પ્રતિકારક શક્તિ રહેલી હોવાથી બાળકને ગાડા, ઉલદી, કદ્દ, શરદી, કાન પાકવા, ગેલર્જી, લોઈનાં પણ થયું, ગાડાના લોહી આપવું, ખરાજું થયું હેવા સેગો ઓળો થાય છે. માતાના ઘાવસાં બેકટેરિયા અને વાયરસ સામે લડવા માટે સેગ પ્રતિકારક શક્તિ હોવાથી પોલિયો, નાપાનીરી એનકેફેલાઈટિસ, ગાલ પણવું, ફલ્લુ હેવા સેગો સામે રક્ષણ આપે છે. જેમને માતાનું દૂધ ન મળું હોય તેવા શિશુઓને જન્મ બાદ તો તકલીફી રહે છે ઉપરાંત મોટા થાય તે પણી પણ તેમને ઘણી શાસ્ત્રીક તકલીફી રહે છે.
- (૩) જરૂરી પોપક તલ્પોથી ભરપુર : માતાના દૂધમાંથી શિશુને જરૂરી બધાંજ વિટામીન અને ઝારો પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. માતાના દૂધમાં માત્ર બે પોપક તલ્પોની ઉંઘાં હોય છે. ૧. વિટામીન - સી અને ૨. આયર્ન. પરંતુ કુદરતે આનું પણ સમાધાન આપી દીશિલ છે. શિશુ ગર્ભાં હોય ત્યારે આ બે પોપક તલ્પોનો તેના શરીરમાં સંગ્રહ કરે છે અને જન્મ બાદ આ પોપક તલ્પો પાસે છે. આ સંગ્રહ કરાવેલા પોપક તલ્પો ઠ થી ૬ મહિના સુધી શરીરને મળતા રહે છે. ત્યારબાદ તેનો જાય્યો પુરો થઈ જાય છે.
- (૪) સગાડભર્યું : માતાનું દૂધ આપવા માટે કોઈ તેચારી કરવી પડતી નથી. કોઈ બીજા સાધનની જરૂર પણ પડતી નથી તેચારી સરળતાથી આપી રહ્યાં હોય છે. માતા બાહારગામ તથા સ્નોલીનોને ત્યાં સહેલાઈથી જઈ શકે અને બાળકને સામે પણ દૂધની જરૂર પડે ત્યારે માતાનું ઘાવસ સહેલાઈથી મળી રહે છે.
- (૫) પાયન અંગે : માતાનું ઘાવસ પચાણાં ઘણું કલકું હોય છે તેનાથી બાળકનું વજન પણ સારી સીતે વધે છે અને બાળક ફુલપુર થાય છે.
- (૬) માનસિક અને શારીરિક લાભ : માતાના ઘાવસ પર ઉંઘેલા બાળકના મગજનો વિકાસ સારો થાય છે. તેણો આનંદી અને શાંત સ્વસ્થાના થાય છે. માતા જાયારે બાળકને ઘઘડાવે છે ત્યારે એક પ્રકારનું માનસિક અને શારીરિક બંધન માતા અને

બાળક પર્યાય થાય છે. તેનાથી માતાને બાળક ઉછેરથી સંતોષ મળે છે. અને બાળક વધારે સુરક્ષિતતા અનુભવે છે. વળી, જે માતા સ્તરનપાણ કરાયે છે તેમનામાં પાછળથી સ્તરનના કેન્સરનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. ઉપરાંત બાળકોમાં ઈલ્ટુસરોપણન લેક્ટિનેરીઓર, અલ્સરેટિય કોલાઇટીસ અને ગુદાની આજુ બાજુ ચામડી આડી થવાના રોગો થવાની શક્યતા વર્દી જાય છે. માતાના ધાવણ પર ઉછેરેલું બાળક વધારે પડતું જાડુ થતું નથી તંદુરસ્ત રહે છે.

- (૭) ઓછું ખર્ચાઈ : આજના મૌદ્યધાવારીના જમાનામાં માતાનું ધાવણ સર્ટું પડે છે અને બાળકને કુપોષણથી (માલન્યુટ્રીશન) બયાપે છે.
- (૮) કોલસ્ટ્રમ અથવા ખીરું : શરીરાતના થોડા દિવસોમાં માતાનું ધાવણ પરિપક્વ દૂધ કરતાં જુડુ હોય છે. જેને ખીરું કરે છે. આ દૂધાં રોગ પ્રતિકરક શક્તિ અને પોટિક તત્ત્વો વધારે પ્રમાણમાં હોય છે. દરેક બાળકને આ મળે તે જરૂરી છે.

શિશુના આહારમાં ખીરા (કોલસ્ટ્રમ)નું મહત્વ

પ્રસૂતિ બાદ શરીરાતના બે થી પ્રશા દિવસ સુધી સ્તરનામાંથી પીળાશ પડતું જાડુ દૂધ આપે છે. આ દૂધ સામાન્ય દૂધ કરતા જુડુ હોય છે. અને તેને ખીરાના નામે ઓળખવામાં આપે છે. આ ખીરામાં બહુ જ વધુ પ્રમાણમાં પ્રોટીન હોય છે. જે શીશુ માટે બહુ જ જરૂરી છે. ઉપરાંત આ પ્રોટીનમાં ડેસીનીન નામનું એક તત્ત્વ રહેલું હોય છે. જે શિશુને રોગ પ્રતિકરક શક્તિ પૂરી પાડે છે. આ દૂધાંમાં ચરણીનું પ્રમાણ ઓછું હોય છે. અને શિશુ સહેલાઈથી પચાસી શકે છે. તેમાં લેક્ટોગ્ન નામનું કાન્ફોઇન્ડ્ડ પણ પ્રમાણમાં ઓછું હોય છે.

ક્રમ	વિગત	માતાનું ધાવણ	ખીર (કોલસ્ટ્રમ)	ગ્રાહણ દૂધ
૧.	પાણી	૮૮	૮૦	૮૮
૨.	પ્રોટીન	૦.૬	૨.૭	૩.૩
૩.	કેસીન	૦.૪	૧.૨	૨.૦
૪.	લેક્ટોગ્લોબિનીન	૦.૪	-	૦.૬
૫.	લેક્ટોગ્લોબિનીન	૦.૨	૧.૫	૦.૨
૬.	બરણી	૧૪.૮	૨.૬	૩.૬
૭.	લેક્ટોગ્ર	૬.૦	૫.૩	૮.૮
૮.	કેન્થિયમ	૩૪	૩૦	૧૧૬
૯.	શોરકરસ	૧૫	૧૫	૬૨
૧૦.	સોડીયમ	૬	૪૮	૨૨
૧૧.	પોટેશિયમ	૧૩	૭૪	૩૫
૧૨.	કલ્લોશાહડ	૧૧	૮૦	૨૬
૧૩.	મેગ્નેશિયમ	૪	૪	૧૨
૧૪.	ટાદ્કર	૧૪	૨૨	૩૦
૧૫.	ક્રોમિયમ	-	-	૧૦
૧૬.	મેગ્નેનીગ	૧૦	૩૮૮	૩૦
૧૭.	ગીક	૪	૬	૪
૧૮.	આયોડિન	૩૦	૧૨૦	૭૦
૧૯.	સેલનિયમ	૩૦	-	૩૦
૨૦.	ઝારન	૦.૫	૦.૧	૦.૫

સામાન્ય રીતે આત્મ પ્રયોગ દિવસ ઈંડ ઓફિસમાં અનેટું રૂપો ૬૦૦ વી ૮૦૦ મિનિટી લીટર ધારણ પેદા કરે છે. આ ધારણાનું સિસ્કુલ્યુને આપારાયક બન્ધાં જ પોષકતાચો હોય છે. માટે આત્મએ તેના સાધારણ આહાર કરતાં દોંગાનો આહાર હોય જરૂરી છે. ઘણાં કુંઠળોના આત્મએને મેલીના લાદુ, સુવા, ગંદોડા, લીલા પણાણાં શાકભાજુ કરેને આપણાં આપે છે. પરંતુ તરફિયરીની દૂધ, આપાર હોય કઢોણ નિશ્ચાસ કરેલ વાનગસીનો કંદફળાઈ, સુકાખેણનો પણ આહારમાં સમાપોસ કર્યો જોઈએ. જેથી માતાને જરૂરી પોર્ટિન, સંકિન, બનીજાતાચો લાને વિટામિનો આપી રાકે.

માતાને કોઈપણ પ્રકારની માંદગી આપે તેવા પ્રસંગોમાં ધારીવાર બાળકને ધાડાવાળનું શકાય બનનું નથી. આવા સંસોગોમાં ધારણાને બાબતે ગ્રાય, બાકી કે બેસનું દૂધ આપી શકાય છે. સામાન્ય રીતે દૂધ રાશેવાઈની પરી ખાય છે. દૂધ તોચાર કરતી વાતે ત્યારાંતા ધાડાવાળનું અનિદ્યાય જરૂરી છે. બાળક છ મહિનાનું ચાચ ત્યાં સુધી તેને ધારણા પૂર્ણ રીત પડે છે. ત્યારાંના બાળકની વૃદ્ધિ અને વિકાસ માટે ધારણાની સાચે પૂરક આહાર આપવો જરૂરી છે. સામાન્ય રીતે બાળક છ મહિનાનું ચાચ ત્યારે ટોપાયમ પ્રયાણી ખોરાક આપણાંનો શરૂ કરી દેયો. જેમકે ધાડાનું પાણી, બાબતનું ઔંસામણ, શાકભાજુનો સૂપ, કંદોળનો રસ, ઘંઠ કે દૂધાંસાંલાં મસાણીને આપી શકાય છે. બાળક છ મહિનાનું ચાચ ત્યારે તેને કેંઠું, પરીનું, પાકી કરી, બાંકું સંકરણ મસાણીને આપી શકાય છે. બાળક છ મહિનાનું ચાચ ત્યારે બાંદા, બાંદેલા, કંદોળ, ખીરડી, ખાતા, કડળી, ટોકણાં પિગેરે આપી શકાય છે. શાકભાજુ અને કંદ બાળકને બનીજાતાચો લાને વિટામિનો પૂરાં પાડે છે.

માતાનું દૂધ, ગ્રાયના દૂધ અને બેસના દૂધ વચ્ચે સરખામણી

પોષક તાચો	માતાનું દૂધ	ગ્રાયનું દૂધ	બેસનું દૂધ
પાણી (ગ્રાય)	૮૮	૮૭.૫	૮૧
ઉના (કાંદોકેલારી)	૬૫	૬૭	૧૧૭
પોર્ટિન (ગ્રાય)	૧.૧	૩.૨	૪.૩
કાંદોનાઈક્રિટ (ગ્રાય)	૭.૪	૪.૪	૫
બટણી (ગ્રાય)	૩.૪	૪.૧	૬.૫
કેલિસામ (મી.ગ્રાય)	૨૮	૧૨૦	૨૧૦
કોટકરસ (મી.ગ્રાય)	૧૧	૬૦	૧૩૦
આસ્કરન (મી.ગ્રાય)	-	૦.૨	૦.૨
કેરોટીન (મી.ગ્રાય)	૧૩૮	૧૬૪	૧૬૦
ધારમીન (મી.ગ્રાય)	૦.૦૨	૦.૦૫	૦.૦૪
રાઈનોકલેચીન (મી.ગ્રાય)	૦.૦૨	૦.૧૮	૦.૧
વિટામિન ટી (મી.ગ્રાય)	૩	૨	૧
કેટસીનોરન્ડ અને લેક્ટાન્ડયુગ્નોનો રેટોચો	૧.૨	૩.૧	-

